

વિશ્વ ઉમિયા સુરક્ષા કવચ - ‘ઉમાછત્ર’ સહાય મેળવવાના ઠરાવો અને ઉદ્દેશો

જગત જનની મા ઉમાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરી સમાજ ભાવના સુદૃઢ કરવાનો સંસ્થાનો ઉદ્દેશ છે. અધ્યાત્મિક ચેતનાની જ્યોત જગાવી સામાજિક અને વ્યાપારિક સંબંધોનાં વૈશ્વિક જોડાણ દ્વારા સમાજના પરિવારોને શિક્ષણ, આરોગ્ય, રોજગાર, વ્યાપાર, સ્પોર્ટ્સ અને કલ્ચરલ ક્ષેત્રે સન્માનપૂર્વક મદદના સંકલ્પ સાથે સંસ્થા કટિબદ્ધ છે. જગત જનની મા ઉમિયાના આશીર્વાદ રૂપે ઉમાછત્રના માધ્યમથી પરિવારમાં યુવાવયે નિધન સમયે આર્થિક સુરક્ષા આપવાનો અભિગમ છે. ઉમાછત્ર સભ્યના જરૂરિયાતમંદ પરિવારોને ભરણ પોષણ, શિક્ષણ તેમજ આરોગ્ય સારવારમાં મદદરૂપ થઈ સમાજ ભાવનાને જીવંત રાખવાનો સંસ્થાનો નમ્ર પ્રયાસ છે.

૧. ઉમાછત્ર યોજનામાં જે કોઈ વ્યક્તિ નિયત યોગદાન જમા કરાવશે તે અપેક્ષા રહિત દાન ગણાશે. ઉમાછત્ર અંતર્ગત પરિવારમાં યુવાવયે નિધન સમયે જગત જનની મા ઉમાના આશીર્વાદ રૂપે સહાય આપવામાં આવશે. સંસ્થાની જુદી જુદી યોજનાઓ અંતર્ગત નિયત ફોર્મ અને યોગદાન ભરીને સહાય મેળવી શકશે.
૨. ઉમાછત્ર સહાય મેળવવા જરૂરી આધાર પુરાવા ફોર્મ સાથે સામેલ કરવાના રહેશે. તેમજ સંસ્થાએ નિયત કરેલ યોગદાન રોકડેથી અથવા ‘વિશ્વ ઉમિયા સુરક્ષા કવચ’ના નામે આપવાનું રહેશે. અથવા ઓનલાઈન યોગદાન અને અરજી ફોર્મ ભરી શકાશે. સદર દાન ઈન્કમેટેક્સ ૮૦જી (પ) મુજબ મુક્તિને પાત્ર છે.
૩. ઉમાછત્ર સહાય માટે ૧૮થી પર વર્ષ વયની સમાજની કોઈપણ શારીરિક, માનસિક તેમજ તંદુરસ્ત વ્યક્તિ અરજી કરી શકશે. ગ્રાહિત કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, કંપની કે પેટી નિયત અરજી તથા યોગદાન જમા કરાવી સંસ્થાને સ્વીકૃત વ્યક્તિને ઉમાછત્ર સભ્ય તરીકે જોડી ઉમાછત્રના ઠરાવો અંતર્ગત સહાય અપાવી શકશે.
૪. ઉમાછત્ર સભ્યનું ૧૮થી ૫૫ વર્ષ દરમિયાન કુદરતી કે આકસ્મિક નિધન થાય તો તેમના પરિવારને ઠરાવોને આધીન રૂ.૬૯ લાખ સહાય મળવાપાત્ર રહેશે.
૫. ઉમાછત્ર સહાયની અરજીમાં જણાવેલ કોષ્ટક મુજબ ત્રણ વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પનું યોગદાન પસંદ કરવાનું રહેશે. NRI માટે US \$ ૫૦૦ યોગદાન રહેશે. ઉમાછત્ર સભ્ય ઈચ્છે ત્યારે અવિરત વિકલ્પ-૩માં ભરેલ ‘પ્રારંભિક યોગદાન’ મજરે મેળવી અવિચલ વિકલ્પ-૧માં બાકીનું યોગદાન ભરીને તબદીલ થઈ શકશે.
૬. અવિરત વિકલ્પ પસંદ કરનાર સભ્યે વયજૂથ પ્રમાણે વર્ષને અંતે ચૂકવાયેલ સહાય વરાડે પડતાં સરેરાશ રૂ.૨૨૦૦/- આસપાસ યોગદાન ACH દ્વારા આપવાનું રહેશે. (રૂ.૨૨૦૦થી વધુ આવે તો પ્રથમ ૧૦,૦૦૦ સભ્યોની ભરપાઈ સંસ્થા કરશે) સદર ACH દર વર્ષે ૩૦મી મે પહેલાં સભ્યના બેંક ખાતામાં આપોઆપ ડેબીટ થશે.
૭. કોઈપણ કારણસર ACH પરત થશે તો ઉમાછત્ર સહાય પુનઃ કાર્યરત કરવા માટે પરત ACH તારીખથી ૬૦ દિનમાં બેંક ચાર્જ સાથે સદર યોગદાન કેશ અથવા ઓનલાઈનથી જમા કરાવવાનું રહેશે અન્યથા સભ્યપદ આપોઆપ રદ થશે. તેમ છતાં ઉમાછત્ર સમિતિનો નિર્ણય આખરી રહેશે.
૮. સભ્યપદની અરજી તથા વિગતો ચકાસણી મંજૂર થયા બાદ પ્રમાણપત્રની તારીખથી અવિચલ વિકલ્પ - ૧ અને સરલ વિકલ્પ - ૨ માં એક વર્ષ બાદ તથા અવિરત વિકલ્પ - ૩ માં બે વર્ષ બાદ ઉમાછત્ર સહાય મળવાપાત્ર થશે. ઉમાછત્ર સભ્ય સાથે રહેતા માતા, પિતા, સંતાનો અથવા પતિ કે પત્નીને જ સહાય મળવાપાત્ર રહેશે.
૯. જો પત્ની પુનઃલગ્ન કરે તો માતા-પિતાને ૪૦% અને સંતાનો રહેવાના હોય તેમને ૬૦% સહાય અપાશે. જેમના પુત્રનું નિધન થયું હોય અથવા પુત્ર નથી એવી ઉમાછત્ર સભ્ય દિકરી વિનંતીપત્ર આપીને સહાયના ૪૦% સુધી પિયરે માતા-પિતાને આપી શકશે. જેમાં કૌટુંબિક સ્થિતિ અનુસાર સંસ્થાનો નિર્ણય સૌને બંધનકર્તા રહેશે.
૧૦. ઉમાછત્ર સભ્યના નિધન બાદ તેમના પરિવારે કૌટુંબિક સંબંધોની પૃષ્ઠિના આધાર પુરાવાની સંસ્થાના નિયત નમૂનામાં બે સાક્ષીઓની કબૂલાત આપવાની રહેશે.
૧૧. કુદરતી કે માનવસર્જિત હોનારત, અકસ્માત કે મહામારીમાં નિયત સરેરાશ મૃત્યુથી વધુ અવસાન પામનાર ઉમાછત્ર સભ્યોના કિસ્સામાં પ્રથમ પયાસ પરિવારોને સભ્ય દીઠ વધુમાં વધુ રૂ.૩,૦૦,૦૦૦/- (અંકે રૂ. ત્રણ લાખ) ચૂકવવામાં આવશે. તેમ છતાં તેમાં ફેરફાર કરવાનો આખરી નિર્ણય સંસ્થાનો રહેશે.
૧૨. અરજી સમયે કિડની, કેન્સર, હૃદય, ફેફસા જેવા ગંભીર રોગ તેમજ જીવલેણ બિમારી હોય તે વ્યક્તિ ઉમાછત્ર સભ્ય થવા પાત્ર નથી. તેમ છતાં સદર માહિતી છુપાવીને સભ્યપદ મેળવેલ હશે તો સહાય મળવાપાત્ર રહેશે નહીં. કોઈપણ પ્રકારની આત્મહત્યા કે અકુદરતી અવસાનમાં ઉમાછત્ર સહાય મળવાપાત્ર નથી.
૧૩. ઉમાછત્ર સભ્યનું નિધનથી અથવા ૫૫ વય થયેથી સભ્યપદ પૂર્ણ થશે અને સંસ્થા તથા ઉમાછત્ર ઠરાવોનો ભંગ કરવાથી સભ્યપદ રદ થશે ભરેલ યોગદાન અને કોઈપણ સહાય મળવાપાત્ર રહેશે નહીં. ઉમાછત્ર અંતર્ગત નક્કી કરેલ ઠરાવોમાં અગાઉથી જાણ કર્યા વગર સંસ્થા સુધારા-વધારા કે ફેરફાર કરી શકશે.
૧૪. ઉમાછત્ર સભ્યના અવસાન બાદ પરિવારે મહત્તમ ૩૦ દિવસ સુધીમાં ઉમાછત્ર સહાયનું નિયત ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજી પુરાવાઓ સાથે સંસ્થાની ઓફિસે આપવાનું રહેશે. જેની ચકાસણી બાદ ઉમાછત્ર સહાયની રકમ સભ્યના પરિવારને ઉમાછત્ર સહાય અંતર્ગત ઠરાવોને આધીન આપવામાં આવશે.
૧૫. ઉમાછત્ર સભ્ય થવા અગાઉ સંસ્થાના તમામ ઠરાવો અને ઉદ્દેશો વાંચી સમજી લેવા ફરજિયાત છે અને તે સિવાયના વખતોવખત થયેલ ઠરાવોનું અમલીકરણ અને અર્થઘટન બાબતે સંસ્થાએ આપેલા નિર્ણયો સામે સંસ્થા કે સંસ્થાના ટ્રસ્ટી, હોદ્દદાર, કર્મચારી કે સહયોગી દાતા પર કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહી કરી શકાશે નહીં. જે દરેક વ્યક્તિ, ઉમાછત્ર સભ્યો અને તેમના વંશ-વાલી, વારસોને કબૂલ મંજૂર રહેશે. જેની આ સાથે બાંહેધરી અને ખાતરી આપું છું.
૧૬. કોઈ પણ પ્રકારની ઉમાછત્ર સહાય પેટે ચૂકવણી ઉપરાંતનું યોગદાન સંસ્થામાં કોર્પસફંડ પેટે જમા રાખવાની મારી સ્વેચ્છાએ સહમતી આપું છું. સદર યોગદાનનો ઉપયોગ મૃત્યુ સહાય, મેડીકલ સારવાર, શિક્ષણ કે કોઈપણ સામાજિક કાર્ય માટે સંસ્થા કરી શકશે, જેમાં મારી અને મારા વંશ-વાલી વારસોની સહમતી છે.

તારીખ :

સ્થળ :

અરજદારની સહી :